

પ્રેસ નોટ

રાજસ્થાન ઉદેપુર શહેરમાં ચાંદીના દાગિનાઓની લુંટ કરનાર બે ઇસમોને ઝડપી પાડતી

કાઇમબ્રાન્ચ

અમદાવાદ શહેર કાઇમ બ્રાન્ચનાં સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી જે.કે.ભટ્ટ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી દીપન ભદ્રન તથા અધિક નાયબ પોલીસ કમિશ્નર શ્રી ડો. રાજદિપસિંહ ઝાલા નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં લુંટના ગુન્હાઓ કરતા આરોપીઓને શોધી કાઢવા સારુ કાઇમ બ્રાંચના અધિકારીઓને સુચના આપેલ. જે અનુસધાને કાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.પી.રોજ્યા, તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એસ.જે.જાડેજા તથા શ્રી એસ.બી.દેસાઇ તથા સ્ટાફનાં માણસોને નરોડા દેવી સિનેમા સામે સોનાચાંદીની દુકાન માં સંડોવાયેલ ઇસમો રાજસ્થાન ઉદેપુર ખાતે હોવાની હકીકત જણાતા ઉદેપુર શહેરમાંથી આરોપીઓ (૧) પ્રવિણસિંહ ડ/૦ રાજેન્દ્રસિંહ હડમતસિંહ જાતે ચૌહાણ ઉવ.૨૪ રહે. હાલ ૩૨૮, બજરંગનગર, સેક્ટર-૧૪, ઉદેપુર, રાજસ્થાન તથા મ.નં. ૨૩, નહેરુનગર, શિરોહી, રાજસ્થાન તથા નં.(૨) નાએ પોતાનું નામ રતન ડ/૦ નંદલાલ છોગાલાલ જાતે ખટીક ઉવ.૨૧ રહે. ઇન્દિરાનકોલોની, વોર્ડ નં.-૧૧, ધુણી, ફતેહનગર રાજસ્થાન નાઓને તા.૨૭/૦૫/૨૦૧૮ વાગે પકડી અટક કરેલ છે.

ઉપરોક્ત આરોપીઓની નરોડા દેવી સિનેમા સામે સોનાચાંદીની દુકાન માં થયેલ લુંટ સંબંધે પુછપરછ કરતા પોતે અમદાવાદ શહેર કે ગુજરાત ના કોઇ શહેરોમાં લુંટ કરેલ નહીં હોવાનું જણાવેલ પરંતુ આજથી સાત આંઠ દિવસ પહેલા પોતે બંને જણા તથા અન્ય સાગરિતો સાથે મળી સ્વીફ્ટ VDA ગાડી લઇને સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે ઉદયાપોલ થી નટરાજ હોટલ વચ્ચે રોડ ઉપર ગાડી ઉભી રાખી વોચ રાખી થોડીવારે ઓટોરિક્ષા આવેલ જેમાં તેઓએ રેકી કરેલ બંને ઇસમો હોય તેમનો પીછો કરી પાશ્વનાથ ટ્રાવેલ્સ એજન્સી ની પહેલા ટર્નીંગ પાસે સ્વીફ્ટ ગાડી ઉભી રાખી નીચે ઉતરી ઓટોરિક્ષા ઉભી રખાવી તેમની પાસેના પાર્સલો ની લુંટ કરી નાસી જઇ પ્રવિણસિંહ ના ઘરે જતા રાહેલ અને જે લુંટ કરેલ પાર્સલમાં ચાંદીના દાગિનાઓ મળી આવેલ તે ઉદેપુર ખાતે સોની ને વેચી ભાગે પડતા પૈસા વહેચી લીધેલ હોવાનું જણાવેલ જેથી સદરી બાબતે રાજસ્થાન ઉદેપુર સુરજ પોલ પોલીસ સ્ટેશન માં ટેલીફોનીક ખાત્રી કરતા સુરજપોલ પોલીસ સ્ટેશન । ગુ.ર.નં. ૧૮૪/૨૦૧૮ ઇપીકો ૩૫૬,૩૭૯ વિગેર મુજબ નો ગુનો દાખલ થયેલ હોય સદરી બંને આરોપીઓને ઉદેપુર શહેર સુરજપોલ પોલીસ સ્ટેશન માં સોંપવા સારુ તજવીજ કરવામાં આવેલ છે.